

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

ઉમેદવારો માટેની સુચનાઓ

INSTRUCTIONS FOR CANDIDATES

જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર ક્લાર્ક(વહીવટ/હિસાબ)

સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ:- ૨૯-૦૧-૨૦૨૩

પરીક્ષાનો સમય:- સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક

1	આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધિત સુચનાઓને આધારે આપે ઓન લાઇન ભરેલ અરજીપત્રમાંની વિગતોની કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા સિવાય તેમજ તે હેઠળના ડીકલેરેશનના ખરાપણાની આધીન રહીને પ્રોવીઝનલ પ્રવેશ આપવામાં આવે છે. ભવિષ્યમાં આપના અરજીપત્ર અને ડેકલેરેશનમાં ક્ષતિ જણાયે મંડળ ધ્વારા આપને કોઇ પણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવી શકશે.
2	પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર કમ પ્રવેશપત્રમાં પોતાનો કલર ફોટો ચોટાડી સાથે અચુક લાવવાનો રહેશે, અન્યથા આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલ હોય તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોટાડવો ફરજિયાત છે.
3	આપને ફાળવેલ ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે પરીક્ષાના દિવસે સવારે ૯:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. અને આપને ફાળવેલ વર્ગખંડમાં આપની બેઠક ઉપર ૧૦:૧૫ કલાકે હાજર થવાનું રહેશે.
4	પરીક્ષા શરૂ થયા પછીથી કોઇ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળી શકશે નહીં તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી કોઇ પણ ઉમેદવાર પરીક્ષાખંડ છોડી શકાશે નહીં.
5	બેન્યુમાર્ક ડીસએબીલીટી અને લેખનક્ષમતાની મર્યાદા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો જેમને લહિયા/વાચકની સુવિધાની જરૂરીયાત હોય તેવા ઉમેદવારોએ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર આ અંગેની સુચના મુજબ જે જિલ્લામાં પરીક્ષા હોય તે જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી, જરૂરીયાત મુજબના આધાર પુરાવા અરજી કરીને લહિયા/વાચક રાખવા માટેની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે. મંજૂરી વગર લહિયા/વાચક ની સુવિધા મળશે નહિ.
6	પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારની ઓળખ માટે ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર અસલમાં ઉમેદવારે સાથે રાખવાનું રહેશે, જે વર્ગનિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.
7	ઉમેદવારને પરીક્ષાખંડમાં જે જવાબપત્ર(OMR Sheet) આપવામાં આવશે, તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારે સહી ઉપરાંત પોતાના ડાબા હાથના અંગૂઠાનું નિશાન (થમ્બ ઇમ્પ્રેશન) પણ ફરજિયાતપણે લગાવવાનો રહેશે. અંગૂઠાનું નિશાન લગાવ્યા બાદ ઉમેદવારને પોતાનો અંગૂઠો ડુમ્મલની મદદથી યોગ્ય રીતે સાફ કરી દેવા સલાહ આપવામાં આવે છે, જેથી તેનું શાહીનું નિશાન OMR શીટ ઉપર બીજી જગ્યાએ પડે નહિ.
8	OMR ઉત્તરપત્ર ઉપર ઉમેદવારે સ્વહસ્તે નિયત જગ્યાએ EXAM NAME અને EXAM DATE લખી નિયત જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે તેમજ OMR ઉત્તરપત્ર ઉપર ઇન્વીજીલેટર (વર્ગનિરીક્ષક) ની સહી કરવામાં આવે તે જોવાનું રહેશે. ઉમેદવારની સહી નહીં હોય તો તેવા OMR ઉત્તરપત્રની ચકાસણી કરવામાં આવશે નહીં.
9	આ પરીક્ષાના પ્રશ્નપત્રનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્ક રીડીંગ) પદ્ધતિનું રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક આંકડામાં દર્શાવવાનો રહેશે તથા ઉત્તરપત્રમાં જે તે પ્રશ્નના ક્રમ સામે દર્શાવેલ ઉત્તર A B C D E પૈકી યોગ્ય જવાબના ખાનામાં O માં બ્લુ/ બ્લેક બોલ પેનથી સંપૂર્ણ • આ પ્રમાણે ઘૂંટીને યોગ્ય જવાબ દર્શાવવાનો રહેશે. દરેક પ્રશ્નના

	જવાબોમાં એક વિકલ્પ 'E' NOT Attempted રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ઇચ્છતા ન હોય તો E વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં.
10	OMR પદ્ધતિથી ઉત્તરપત્રમાં જવાબો લખતા પહેલા તે અંગેની ઉત્તરપત્ર OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા, OMR ઉત્તરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ(A,B,C,D,E,F) પૈકી જે સીરીઝનું પ્રશ્નપત્ર ઉમેદવારને મળેલ હોય તે) અંગ્રેજી અક્ષરમાં દર્શાવવાનો રહેશે. અન્યથા ક્ષતિયુક્ત ઉત્તરપત્ર OMR રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહીં, જેની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉત્તરપત્ર ઉપર અન્ય કોઈ લખાણ કે ઓળખ અંગેના ચિહ્ન કરવા નહીં અન્યથા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવવામાં આવશે.
11	OMR પદ્ધતિથી ઉત્તરપત્રોના મુલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધુરુ ઘુટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઈને ખોટા, છેકછાકવાળા, અધુરુ ઘુટેલુ વર્તુળ, એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મુલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સુચનાઓ મુજબ (માઇનસ પદ્ધતિથી) કરવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક, અધુરુ ઘુટેલુ વર્તુળ, કે એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ 0.33 માઇનસ ગુણ કાપવામાં આવશે.
12	ઉત્તરપત્રમાં લખવા માટે બ્લુ/ બ્લેક રંગની બોલ પેનનો જ ઉપયોગ કરવો. અન્ય રંગની બોલપેનનો ઉપયોગ પ્રતિબંધિત છે. પેન્સિલનો ઉપયોગ કર્યો હશે તો ક્ષતિયુક્ત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ઉત્તરપત્ર ચકાસશે નહીં જેની જવાબદારી ઉમેદવારની રહેશે. White Ink નો ઉપયોગ પ્રતિબંધિત છે.
13	ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકની નીચેના ભાગનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી પોતાનું ઉત્તરપત્ર (OMR Sheet), પરીક્ષાખંડના નિરીક્ષકશ્રીને પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે. તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે.
14	ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર, પેન અને ઓળખના પુરાવા સિવાય કોઈપણ ચીજ સાથે રાખી શકશે નહીં. ઉમેદવારે કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, સ્માર્ટવોચ, મોબાઇલ (સ્વીચઓફ કે સાયલેન્ટમોડ કરેલ હશે તો પણ) કેલક્યુલેટર, બ્લ્યુટુથ, ઇયરફોન વિગેરે જેવા કોઈ પણ વિજાણું સાધનો રાખવા નહીં. આવી વસ્તુ(ઓ) આપની પાસેથી મળી આવશે તો, આપ ગેરલાયક ઠરશે, ઉપરાંત, આવી વસ્તુ(ઓ) જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગના ફોજદારી પગલાને પાત્ર પણ ઠરશે.
15	ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહીં. તેમજ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહીં.
16	ઉમેદવાર નકલ કરતા, ગેરરીતી/ગેરશિસ્ત આચરતા જણાશે, તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલા સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
17	કોવિડ-૨૦૧૯/૨૦૨૩ અંતર્ગત કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી ધ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
18	ચેતવણી:- મંડળ ધ્વારા થઇ રહેલ આ ભરતી પ્રક્રિયામાં આપ કે આપના વતી અન્ય ત્રાહિત વ્યક્તિ ધ્વારા મંડળ ઉપર અથવા મંડળના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપર કોઈપણ જાતની ભલામણ, લાગવગ કે દબાણ લાવવાનો પ્રયાસ કરાશે તો, તેવા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
19	ઉમેદવારને લાંચ રૂઝત/ લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે.